

પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૪/૦૨/૨૦૨૨ થી તા.૨૦/૦૨/૨૦૨૨ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય:-

(૧) માધવપુર પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૨૭/૨૦૨૨ I.P.C. ક.૩૬૩, ૩૬૬ તા.૧૪/૦૨/૨૦૨૨ના કામે અપહરણ થનાર કાજલબેન D/O મેણંદભાઈ સોલંકી ઉ.વ.૧૭ વર્ષ, ૬ માસ રહે.બળેજ ગામ, તા.જી.પોરબંદરને તા.૧૫/૦૨/૨૦૨૨ના રોજ સર્કલ પો.ઇન્સ.શ્રી એચ.એલ.આહિર તથા પોલીસ સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.

(૨) મીયાણી પો.સ્ટે જા.જોગ નં. ૦૩/૨૦૧૮ તા.૧૪/૦૮/૨૦૧૮ના કામે ગુમ થનાર મનિષાબેન વા/ઓ નિલેશભાઈ કારાવદરા ઉ.વ.૨૫ રહે.રાતડી ગામ તા.જી.પોરબંદરને તા.૧૮/૦૨/૨૦૨૨ના રોજ કોઠારીયા રોડ રાજકોટ થી મિયાણી પો.સ્ટે.ના ઇ.ચા.પો.ઇન્સ.શ્રી આર.એચ.જારીયા તથા પોલીસ સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.

મુદ્દા નંબર ૨:- શાળા કોલેજમાં ચર્ચ/ડીબેટ/અથવા તો અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યાં હોય :-

(૧) તા.૧૪/૦૨/૨૦૨૨ થી તા.૨૦/૦૨/૨૦૨૨ ના ક.૧૨/૦૦ થી ક.૧૩/૦૦ દરમ્યાન મહીલા પો.સ્ટે. ના WASI એમ.આર.ચૌહાણ, PC લખમણભાઈ પરબતભાઈ તથા WLR રમાબેન નથુભાઈનાઓએ ગોઢાણીયા કોલેજ તથા વી.જે.મોઢા કોલેજના વિદ્યાર્થીઓની મુલાકાત લઈ ૧૦૦ નંબર તેમજ ૧૮૧ બાબતે વાકેફ કરી અને પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરવું તે અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. તે સિવાય અન્ય કોઈ તકલીફ જણાય આવ્યે થી નજીકના પો.સ્ટે. તથા ૧૦૦ નંબર તથા ૧૮૧ માં જાણ કરવા સુચના કરેલ.

મુદ્દા નંબર ૪:- ગુન્હાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય :-

(૧) ઉદ્યોગનગર ગુ.ર.નં. પાર્ટ એ ૧૧૨૧૮૦૧૦૨૨૦૦૭૯/૨૦૨૨ IPC ક.૩૧૮ મુજબના કામના અજાણી આરોપી સ્ત્રીએ પોતાના બાળકનો જન્મ છુપાવવાના ઈરાદે મૃત દેહનો છુપી રીતે નિકાલ કરી ગુન્હો કરેલ હોય જે અંગે ઉદ્યોગનગર પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. શ્રી એસ.એ.સોલંકીએ બનાવવાળી જગ્યાની આસપાસના લોકોની પુછ-પરછ કરી તેમજ સીસીટીવી ફુટેજ આધારે તેમજ શહેર અને જીલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પ્રસુતા મહિલાઓની તપાસ હાથ ધરી આ કામે હલીમા હોસ્પિટલ ખાતે જન્મ રજીસ્ટર ચેક કરતા તેમાં બનાવના દિવસની એક પ્રસુતાની નોંધ શંકાસ્પદ જણાઇ આવતા આ બાબતે ખાનગીરાહે ચોક્કસ હકીકત મેળવી આ કામે બાળકીને જન્મ આપનાર સગીરાને શોધી કાઢી તેમની હકીકત આધારે આ નવજાત બાળકીને જન્મ આપનાર સગીરા માતાના પિતાએ જીવીત નવજાત બાળકીને પોરબંદર કર્લીના પુલ ઉપરથી નીચે ફેંકી દેતા તેના માથામાં ગંભીર ઇજા થતા મરણ ગયેલ હોય. જેથી સદર ગુન્હામાં IPC ક.૩૦૨ નો ઉમેરો કરવામાં આવેલ. તેમજ નવજાત બાળકીને જન્મ આપનાર સગીરા માતા દુષ્કર્મનો ભોગ બનેલ હોય, જેથી ભોગ બનનાર સગીરાની બનાવ અનુરૂપ ફરીયાદ લઈ સદર બનાવ રાણાવાવ પો.સ્ટે. હદ વિસ્તાર ખાતે બનેલ હોય. જેથી આ બાબતે રાણાવાવ પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. અને ઉપરોક્ત કામગીરી ઉદ્યોગનગર પો.સ્ટે. અધિકારી/કર્મચારીઓ દ્વારા અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરેલ. આ કામેના આરોપી કીશાભાઈ પાંચાભાઈ છેલાણાને તા.૨૦/૦૨/૨૦૨૨ ના રોજ ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે.

મુદ્દા નંબર ૫:- વૃધ્ધો મહીલાઓ કે બાળકોની સુરક્ષા માટેની વિશિષ્ટ કામગીરી :-

(૧) તા.૧૪/૦૨/૨૦૨૨ થી તા.૨૦/૦૨/૨૦૨૨ સુધી હાર્બર મરીન પો.સ્ટે. ના અધિકારી/કર્મચારીઓ તથા સી-ટીમ દ્વારા પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગ દરમ્યાન સુભાષનગર વિસ્તારમાં આવેલ હીરાવતી કંપનીના મેનેજરની મુલાકાત લઈ કંપનીમાં કામ કરતી મહીલાઓ કામ પરથી પરત તેમના ઘરે સુરક્ષીત પહોંચાડવા સુચના કરેલ. તેમજ કુછડી અને ઓડેર ગામે સીનીયર સીટીઝનની મુલાકાત લેવામાં આવેલ. તેમજ કોવીડ-૧૯ ના સંક્રમણને ધ્યાને લઈ પર માસ્કનું વિતરણ કરવામાં આવેલ અને લોકોને કોવીડ-૧૯ બાબતે સરકારશ્રીએ બહાર પાડેલ ગાઈડ લાઈનનું પાલન કરવા અને કોવીડ-૧૯ બાબતે જરૂરી તકેદારી રાખવા સમજ કરેલ.

મુદ્દા નંબર ૬:- અન્ય લોકહીતની બાબતો જે લોકોને તુરંત જ ધ્યાન પર આવે તેવી બાબતો :-

(૧) તા.૧૪/૦૨/૨૦૨૨ થી તા.૨૦/૦૨/૨૦૨૨ સુધી કમલાબાગ પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓ દ્વારા પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગ દરમ્યાન લોકોને કોવીડ-૧૯ બાબતે સરકારશ્રીએ બહાર પાડેલ ગાઈડ લાઈનનું પાલન કરવા તેમજ શું કાળજી રાખવી તે બાબતે જરૂરી તકેદારી રાખવા સમજ કરેલ. તેમજ ૬૦ માસ્કનું વિતરણ કરેલ.

(૨) તા.૧૪/૦૨/૨૦૨૨ થી તા.૨૦/૦૨/૨૦૨૨ સુધી ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારના અધિકારી/કર્મચારીઓ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન ૧૯૫ માસ્કનું વિતરણ કરી માસ્ક પહેરવા તથા સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ કોરોના વાયરસની મહામારીથી બચવા જરૂરી તકેદારી તેમજ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબના નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવેલ.

(૩) તા.૧૪/૦૨/૨૦૨૨ થી તા.૨૦/૦૨/૨૦૨૨ દરમ્યાન મહીલા પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓ દ્વારા પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગ દરમ્યાન કોવીડ-૧૯ ના સંક્રમણને ધ્યાને લઈ ૧૫ માસ્કનું વિતરણ કરવામાં આવેલ અને લોકોને કોવીડ-૧૯ બાબતે સરકારશ્રીએ બહાર પાડેલ ગાઈડ લાઈનનું પાલન કરવા અને કોવીડ-૧૯ બાબતે જરૂરી તકેદારી રાખવા સમજ કરેલ.

જે આપશ્રીને વિદિત થાય.

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર eGujcop

પોરબંદર